



Shri Govind Guru University
(Established Vide Gujarat Act No. 24/2015)



श्री गोविंद गुरु युनिवर्सिटी
(ગુજરાત એક્ટ નં. ૨૪/૨૦૧૫ દ્વારા સ્થાપિત)
મુ. પો. વિ. ગોધરા, જિ. પંચમહાલ- ૩૮૮૭૧૩

वसुधैव कुटुम्बकम्
ONE EARTH • ONE FAMILY • ONE FUTURE

નં. એસજીજીયુ/પરીક્ષા/૨૦૨૩/૫૩૫૯

તા. ૨૩/૦૮/૨૦૨૩

પરિપત્ર- ૩૧૪૩

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન બી.પી.ટી., બી.એસ.સી. નર્સિંગ, એમ.એસ.સી. નર્સિંગ, પી.બી. બી.એસ.સી. નર્સિંગ, બી.બી.એ.એચ.એમ. અને બી.એચ.ટી.એમ. અભ્યાસક્રમ ચલાવતી તમામ કોલેજોના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, આપની કોલેજમાં નીચે મુજબના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરીક્ષા આવેદન પત્રો નીચે દર્શાવેલ સૂચનાઓ અને તારીખ મુજબ ભરવા અને યુનિવર્સિટી કાર્યાલય ખાતે ફક્ત રૂબરૂમાં જમા કરાવવા જરૂરી કાર્યવાહી કરવા વિનંતી.

Sr	Course	Year / Semester	Exam Fee	Regular Fee Last Date
1	B.P.T.	3 rd & 4 th Year	2800/-	31/08/2023
2	B.Sc. Nursing	3 rd & 4 th Year 1 th Semester	2335/- (Yearly/Semester)	
3	P.B. B.Sc. Nursing	2 nd Year	2335/-	
4	M.Sc. Nursing	1 st & 2 nd Year	2995/-	
5	B.H.T.M.	2 nd & 4 th Semester	1705/-	
6	B.B.A.H.M.	2 nd Semester	1125/-	

પરીક્ષા આવેદનપત્ર ભરવા અને યુનિવર્સિટી કાર્યાલય ખાતે જમા કરાવવા સંબંધિત સૂચનાઓ :

તમમાં આવેદન પત્રો ભરવા માટે કોલેજ શેક્ષણિક વર્ષ - ૨૦૨૨-૨૦૨૩ પસંદ કરવાનું રહેશે તેમજ બી.એસ.સી. નર્સિંગ સેમેસ્ટર - ૧ તેમજ પ્રથમ વર્ષ એમ.એસ.સી. નર્સિંગ ના પરીક્ષા આવેદન પત્રો <http://sgguerp.in/> પર કોલેજના લોગીન કરીને ભરવાના રહેશે. પ્રથમ વર્ષ એમ.એસ.સી. નર્સિંગ રીપીટર ના પરીક્ષા ફોર્મ <https://sggu.icrp.in/> પર કોલેજના લોગીન કરીને ભરવાના રહેશે.

- (૧) સંબંધિત કોલેજોએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પોર્ટલ પર તેમને ફાળવેલ યુઝર આઈ.ડી. દ્વારા લોગીન થઈ પરીક્ષા આવેદનપત્ર ઓનલાઈન ભરી, વેરીફાઈ કરી તેની પ્રિન્ટઆઉટ લેવાની રહેશે.
- (૨) પરીક્ષા આવેદનપત્રની પ્રિન્ટઆઉટની વિગતોની સંબંધિત વિદ્યાર્થી પાસે ખરાઈ કરાવી તેમાં તેની સહી કરાવવાની રહેશે.
- (૩) વિદ્યાર્થીએ સહી કરેલ પરીક્ષા આવેદનપત્રની પ્રિન્ટઆઉટ પર સંબંધિત કોલેજના આચાર્યશ્રીએ ખરાઈ કરી પોતાની સહી અને સિક્કા કરવાના રહેશે.
- (૪) પરીક્ષા આવેદન પત્રની જરૂરી ફી પોર્ટલમાં વેરીફાઈ કરેલ ફોર્મના આધારે સોફ્ટવેર દ્વારા દર્શાવેલ રકમ પોર્ટલમાં દર્શાવેલડીજિટલ ગેટવે અથવા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએકઝામિનેશન, ગોધરાના એક્સીસ બેંકના ખાતા નં.918010086166147 (IFSC CODE: UTIB0000264 MICR: 389211002) માં NEFT/RTGS થી ભરવાની રહેશે.



Shri Govind Guru University
(Established Vide Gujarat Act No. 24/2015)



શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
(ગુજરાત એક્ટ નં. ૨૪/૨૦૧૫ દ્વારા સ્થાપિત)
મુ. પો. વિઝોલ, તા. ગોધરા, જિ. પંચમહાલ- ૩૮૮૭૧૩

वसुधैव कुटुम्बकम्
ONE EARTH • ONE FAMILY • ONE FUTURE

(૫) આચાર્યશ્રી અને વિદ્યાર્થી દ્વારા ખરાઈ થયેલ પરીક્ષા આવેદનપત્રનું ચેકલીસ્ટ, નિયત પરીક્ષા ફી ની ઓનલાઈન જનરેટ થયેલ રીસીપ્ટની નકલ/ફી ભર્યાની રીસીપ્ટ તેમજ રીપોર્ટ મોડ્યુલમાંથી જનરેટ થયેલ ચેકલીસ્ટ રીપોર્ટ યુનિવર્સિટી કાર્યાલયમાં ૨ (બે) કોપીમાં તા.૦૪/૦૯/૨૦૨૩ સુધીમાં ફક્ત રૂબરૂમાં જમા કરાવવાનો રહેશે. (૨૭.૯/૨૦૨૩ પોસ્ટ/કુરિયર કરવું નહીં) (પરીક્ષા આવેદનપત્રની હાર્ડકોપી યુનિવર્સિટીમાં જમા કરાવવાની નથી)

રૂ. ૫૦૦/- લેઈટ ફી સાથે પરીક્ષા આવેદન પત્ર સ્વીકારવાની તારીખ	રૂ. ૧૦૦૦/- લેઈટ ફી સાથે પરીક્ષા આવેદન પત્ર સ્વીકારવાની તારીખ
રેગ્યુલર ફી + રૂ. ૫૦૦/- તા.૦૧/૦૯/૨૦૨૩	રેગ્યુલર ફી + રૂ. ૧૦૦૦/- તા.૦૨/૦૯/૨૦૨૩

(૬) યુનિવર્સિટી ખાતે પરીક્ષા આવેદન પત્રનું ચેકલીસ્ટ મોકલતા અગાઉ તમામ પ્રકારની ચકાસણી કરી લેવી જેથી બાદમાં સુધારા-વધારા કરવાં માટેની કોઈ કાર્યવાહી કરવી પડે નહિ. અધુરી કે ખોટી વિગતોવાળા આવેલ આવેદનપત્રો મોકલવામાં આવશે અને તેના કારણે વિદ્યાર્થીના નામમાં, વિષયમાં, ફોટામાં કે અન્ય કોઈ બાબતમાં ક્ષતિ જણાશે તો તે અંગે યુનિવર્સિટીની કોઈ જવાબદારી રહેશે નહિ.

(૭) કોલેજોએ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કાર્યાલય ખાતે ફોર્મ જમા કરાવવા મોકલવા નહિ, જેની ખાસ નોંધ લેવી.

નોંધ

- જે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાંથી FAEC મેળવ્યું નહીં હોય તેવા વિદ્યાર્થીઓના પરીક્ષા આવેદન પત્રો ભરી શકાશે નહીં. FAEC મેળવ્યા બાદ જ સંબંધિત વિદ્યાર્થીઓના પરીક્ષા આવેદન પત્ર ભરી શકાશે.
- પોર્ટલમાં દર્શાવેલ પરીક્ષા આવેદન ફીની કુલ રકમ વિદ્યાર્થી દીઠ રૂ. ૪.૫૦/- કપાત કરીને ગણતરીમાં લીધેલ હોય પોર્ટલમાં દર્શાવ્યા મુજબની પૂરી ફી ભરવી.

બીડાણ :

- નવા મોડ્યુઅલનું (SGGUERP) યુઝર મેનુઅલ આ સાથે સામેલ રાખેલ છે.



પરીક્ષા નિયામક
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
વિઝોલ(ગોધરા).

પ્રતિ,

- શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન બી.પી.ટી., બી.એસ.સી. નર્સિંગ, એમ.એસ.સી. નર્સિંગ, પી.બી. બી.એસ.સી. નર્સિંગ, બી.બી.એ.એચ.એમ. અને બી.એચ.ટી.એમ. ચલાવતી તમામ કોલેજોના આચાર્યશ્રીઓ તરફ જાણ તથા જરૂરી કાર્યવાહી સારૂ.

Help Manual (NEW ERP)

Subject Selection mapping Module For college


**Shri Govind Guru University,
Vinzol (Godhra)**

College /Department Subject Mapping

- Logging Your Username and password

<https://sgguerp.in/>

- Select [College / Department Management](#) module



Step : 1

- Go to College Department Configuration then select college/Department Subject Mapping
- Choose subject for which your college has been granted university permission

Department

View College / Department Subject Mapping Details

PLEASE CLICK + Add NEW COLLEGE DEPTMENT SUBJECT MAPPING

Admission Year :* 2022-2023

College / Department Subject Mapping

Program Name :* -Please Select-

Academic Batch Name :* -Please Select-

Show 20 entries per page Search

Sr. No.	Admission Year	College / Department Name	Program Name	Academic Batch Name	Term	No. of Subjects	Edit	Delete
No data available in table								

Showing 0 to 0 of 0 entries Previous Next

- Click “ + “ Symbol Add New College/Department Subject Mapping.
- Select Program Name, Academic Batch Name and Term. Then Select Check box for your college/Department Subject mapping
- Also View College/Department Subject Mapping

The screenshot shows a web application interface for adding a new college/department subject mapping. The interface includes a sidebar menu on the left and a main form area. The form has several dropdown menus for 'Admission Year', 'College | Department', 'Program Name', 'Academic Batch Name', and 'Term'. Below these is a 'Subject Details' section with a table of subjects and checkboxes for selection. A red arrow points to the checkbox for 'BAEngCC1011 - SANSKRIT: P1. BHUTAHARI: NITISHATAK'.

No.	Subject Details
FOUNDATION CLASSICAL LANGUAGE : (Select atleast 1 of the following)	
<input checked="" type="checkbox"/>	BAEngCC1011 - SANSKRIT: P1. BHUTAHARI: NITISHATAK
FOUNDATION : (Select atleast 2 of the following)	
<input type="checkbox"/>	BAEngFC101A - COMPULSORY ENGLISH
<input type="checkbox"/>	BAHinFC101B - FOUNDATION HINDI: HINDI KAHANI SAHITY: KAHANI NAYI PURANI
CORE : (Select atleast 2 of the following)	
<input type="checkbox"/>	BAEcoCC1010 - ECONOMICS : P1 ELEMENTARY ECONOMICS -1
<input type="checkbox"/>	BAEcoCC1020 - ECONOMICS : P2 INDIAN ECONOMY -1
<input type="checkbox"/>	BAEngCC1010 - ENGLISH: P1 SHORT STORY FORM
<input type="checkbox"/>	BAEngCC1020 - ENGLISH: P2 LYRIC FORM

Step : 2

I. Student Subject mapping

- Student Configuration
- Go to Student Configuration select Student Subject mapping

The screenshot displays the 'View Student Subject Mapping Details' interface. On the left, a dark sidebar contains navigation links: Home, Dashboard, Masters, College / Department Configuration, and Student Configuration. A red arrow points from the 'Student Configuration' link to the main content area. The main area features a '+ Add New Student Subject mapping' button with a red arrow pointing to it. Below the button are four dropdown menus: 'Admission Year:' (set to 2022-2023), 'College / Department Name:' (set to -Please Select-), 'Program Name:' (set to -Please Select-), and 'Academic Batch Name:' (set to -Please Select-). A search bar is located below these fields. The table below has columns: Sr. No., Academic Year, College / Department Name, Program Name, Academic Batch Name, Enrollment Term, Student Name, Type, Is MBP Subject Selection?, View, Edit, and Delete. The table is currently empty, displaying 'No data available in table'. At the bottom, it shows 'Showing 0 to 0 of 0 entries' and 'Previous Next' buttons.

- Click “ + “ Symbol Add New Student Subject Mapping .
- Select Program Name, Academic Batch Name and Term Syllabus batch Name. Then Select Check box for your Student Subject mapping and also Select Student for this Subject. check all Details after you St
- To delete All student subject selected for click cancel option Only one student deleted for × click Symbol
- Also View Student Subject Mapping.

Program Name: * [] Academic Batch Name: * []

Term: * [] Syllabus Batch Name: * []

Stream: [-All-] Medium: [-All-]

Subject Details

Levels: [-Select All-]

No.	Subject Details
<input checked="" type="checkbox"/>	BITeCC310 - PROGRAMMING IN C
<input checked="" type="checkbox"/>	BITeCC304 - ENGLISH LANGUAGE & COMMUNICATION SKILLS
<input checked="" type="checkbox"/>	BITeCC1630 - COMPUTER FUNDAMENTALS & EMERGING TECHNOLOGY
<input type="checkbox"/>	BITeCC320 - NETWORKING, INTERNET & WEB PAGE DEVELOPMENT

PRACTICAL: (Select atleast 2 of the following)

<input checked="" type="checkbox"/>	BITprCC1850 - PRACTICAL - 1
<input type="checkbox"/>	BITprCC1850 - PRACTICAL - 2

Student Details

Student: * []

[Select All]

[Submit] [Cancel]

II. Release Student Subject Selection

- Select Program Name, Academic Batch Name and Term, Syllabus batch Name Freeze Data.

Admission Year : * 2022-2023

College / Department : *

Program Name : *

Academic Batch Name : *

Syllabus Batch Name : *

Term : *

Unfreeze

View Students : *

Subject Selection Release Pending

Subject Selection Released

Subject Selection Pending

Unrelease Subject Selection (Withdrawal Cases)

Specialization : Please Select

Student Details

Select Checkbox then submit

Sr. No.	Enrollment No.	Student Name	Subject Count	View
1	E220E310001110001	ARDESHA ANUSHYA YATINBHAI	6	<input type="checkbox"/>
2	E220E310001110002	BARINDYA URTHA PKRSOTAMBHAI	6	<input type="checkbox"/>
3	E220E310001110003	BHATT LENCHIBEN YOGESHBHAI	6	<input type="checkbox"/>

- Then show view student option Select any one option
 - A. Subject Selection Release Pending,
 - B. Subject Selection Released,
 - C. Subject Selection Pending,
 - D. Unrelease Subject Selection (Withdrawal Cases)

- Show Student Details check All Details and select Check box then Submit to this page.

III. Student Division Mapping

- Go to master and Select program Term Division mapping
- Go to College Department > Master and Click Program Term Division
- New Add program Term Division

The screenshot shows a dashboard for a Department. The left sidebar contains navigation options: Home, Dashboard, Masters, College / Department Configuration, and Student Configuration. The main area has filters for Admission Year (2022-2023), College, Batch (MSW 2022-23), and Semester (M.S.W Semester - I). A red arrow points to the 'Program Term Division Mapping' link in the sidebar. The dashboard features three summary cards: 'NO. OF PROGRAM' (1), 'NO. OF STUDENT' (44), and 'NO. OF TEACHER' (22). Below these are two charts: 'Program Wise Student' (a blue oval) and 'Semester Category And Gender Wise Student' (a table). The table shows student counts by gender and category.

	EWS	General	SC	SEBC	ST
Female	7	24	42	31	0
Male	0	25	33	14	0

Department

- Home
- Dashboard
- Masters
- College / Department Configuration
- Student Configuration

Add Program Term Division Mapping

Admission Year: *

College / Department: *

Program Name: *

Academic Batch Name: *

Term: *

Division Details

Add Division

Sr. No.	Medium	College Program Type	Division Name	Is Active	Remove
1	None selected -	None selected -	<input type="text"/>	<input checked="" type="checkbox"/>	X

- Click “+” Symbol then Add a new program Term Division Mapping.
- No, of Division. example No of Division: -1 open one column and also add one or more Division click add Divi.
- Also View program Term Division Mapping.

- Go to College Department Select Student Division Mapping.
- Click “ + “ Symbol Add New Student Division Mapping.
- Also View Student Subject Mapping.

Department View Student Division Mapping

Home
Dashboard
Masters
College/Department Configuration
Student Configuration

+ Add New Student Division mapping

Admission Year: 2022-2023

College/Department: -Please Select-

Division Name: -Please Select-

Search:

Department Name	Term	Division Name	No Of Students	Add Student	Edit / View	Delete
No data available in table						

Showing 0 to 0 of 0 entries

Previous Next

College / Department Configuration

Student Configuration

College / Department: *

Program Name: *

Academic Batch Name: *

Term: *

Unfreeze

Division: * BSCA

Filter Criteria

Filter By: -Please Select-

From: To: Generate

Select student

Students records

Sr. No.	Enrollment No.	Surname	Name	Father's Name

select submit

Submit Cancel

- Select Program Name, Academic Batch Name and Term, Syllabus batch Name Freeze Data.
- After Select Division, Select Filter option Garnet and select checkbox for Student Details Submit to page.

IV. Student Roll Number

- Go to College Department Select Student Roll Number.
- Select Program Name, Academic Batch Name and Term, Syllabus batch

The screenshot shows a web application interface for generating student roll numbers. On the left is a dark sidebar with navigation options: Home, Dashboard, Masters, College / Department Configuration, and Student Configuration. The main content area is white and contains several input fields and buttons. At the top right of the main area is a green circular icon with a white plus sign. The form includes the following elements:

- Admission Year:** A dropdown menu showing "2022-2023".
- College / Department:** A dropdown menu.
- Program Name:** A dropdown menu.
- Academic Batch Name:** A dropdown menu.
- Term:** A dropdown menu.
- Unfreeze:** A blue button.
- Division:** A dropdown menu showing "--Please Select--".
- Generate Roll Nos Automatically?:** A checked checkbox.
- Roll No Configuration:** A section containing:
 - Prefix:** An input field.
 - Start No.:** An input field.
- Student Details:** A section containing:
 - Sorting Type:** A dropdown menu showing "Ascending".
 - Sorting Preferences:** A dropdown menu showing "Name - Father's Name - Surname - Enrollment No".
 - Generate:** A blue button.
- Submit / Cancel:** Two buttons at the bottom of the form.

Name and Freeze Data.

- Select Division. Generate Roll Nos Automatically Click Checkbox. And generate roll no. all student detail show and seat no

Help Manual

Pre-Examination Module For College

**Shri Govind Guru University,
Vinzol (Godhra)**

Table of Contents

1. Generate Provisional Exam Form.....	3
2. Examination Form and College Verification	4
3. Activity Wise Payment (Exam Activity).....	5
4. Payment Transaction Search	6

1. Generate Provisional Exam Form

Insert Functionality:

- The page shall allow the Colleges to generate provisional exam forms in bulk.

The screenshot displays the 'Generate Provisional Exam Form' interface. The top navigation bar shows the academic year as 2022-2023 and the user is logged in as 'Welcome - SHREE SHAMALAJI NURSING COLLEGE, GODHRA'. The sidebar menu includes options like HOME, DASHBOARD, ENROLMENT / PG REGISTRATION, REPORT, and PRE-EXAMINATION. The main content area features a form with the following fields:

- College: Shree Shamalaji Nursing College, Godhra
- Program: B.Sc. Nursing
- Program Term: B.Sc. Nursing Semester - 1
- Exam: B.S.C. NURSING SEMESTER - 1 SEPTEMBER-2023
- Exam Type: Regular

Below the form is a table titled 'Student Details:' with the following data:

<input checked="" type="checkbox"/>	Sr No.	SP ID	Enrolment No	Name	Father Name	Surname	Academic Batch	Enrolment Year	Specialization / Major Type Name
<input checked="" type="checkbox"/>	1	2022001366	E22080066080310001				B.Sc. Nursing 2022-2023	2022-2023	

A note below the table states: 'Note : On click of Generate, Provisional Exam Forms would be generated with Latest available Subject Selection from College/Department. Student should approach their College/Department and make necessary changes of their Subject Selection before Submitting Final Exam Forms for Verification.' A 'Generate' button is located at the bottom of the form area.

View Functionality:

- User can View all records.
- Users can also Export/ Delete Multiple records.

2. Examination Form and College Verification

Insert Functionality:



- College User can verify Exam form of students **one by one**.
- College user also selects Answering Language, Payment Information and also change Subject selection if required of selected students.

The screenshot displays the 'Examination Form & College Verification' page on the SGGU website. The browser address bar shows 'ums.sgguerp.in/PreExam/ExamForm.aspx'. The page features a dark sidebar with navigation options: HOME, DASHBOARD, ENROLMENT / PG REGISTRATION, REPORT, and PRE-EXAMINATION. The main content area includes a form with the following fields: College (Shree Shamalaji Nursing College, Godhra), Program (B.Sc. Nursing), Program Form (B.Sc. Nursing Semester - 1), and a dropdown for 'RSING SEMESTER - 1 SEPTEMBER-2023'. A 'Find' button is visible. A search dropdown menu is open, showing a selection of 'E2208006080310001 - 1'. The footer of the page indicates 'Design By Guj Info Petro Limited'. The Windows taskbar at the bottom shows the system time as 12:11 PM on 22-Aug-23.

3. Activity Wise Payment (Exam Activity)

Functionality:

- College User can generate challan for bulk of Examination forms.
- Upon generation of challan a unique challan number will be generated which will be used in payments.
- List of applicants will be shown after selected parameter search with having check box selection facility by which bulk payment process will be done.
- If user selects Online or NEFT/ RTGS option then related Online or NEFT/ RTGS No, Date and Bank Name are entered then challan will be printed for colleges.



4. Payment Transaction Search

Functionality:

- Using this page, university/ college user can update payment status of offline / online payments with Re-initiate payment.
- Payment list will be populated as per selection of fields.
- In form's list we can see the "No of Students, Payment Information's, Re-initiate Payment"
- In form's list we can delete payment of those whose status is pending.
- User can also export payment list in excel from EXPORT ALL button.
- User can also view students list from "Number of students" field.

The screenshot displays the 'Payment Transaction Search' page within the SGGU ERP system. The browser address bar shows the URL: ums.sgguerp.in/PreExam/ExamPaymentTransactionSearch.aspx. The page features a dark sidebar on the left with navigation options: HOME, DASHBOARD, ENROLLMENT / PG REGISTRATION, REPORT, and PRE-EXAMINATION. The 'PRE-EXAMINATION' menu is expanded, showing options like 'GENERATE PROVISIONAL EXAM FORM', 'EXAMINATION FORM & COLLEGE VERIFICATION', 'EXAM FORM SEARCH', 'APPLICANT LIST FOR PAYMENT (EXAM ACTIVITY WISE)', 'PAYMENT TRANSACTION SEARCH', and 'EXAM PAYMENT COLLECTION'. The main content area is titled 'Payment Transaction Search' and contains a search form with the following fields: Activity (Examination Form), College Name (Shree Shamalaji Nursing College, Godhra), Faculty Name (MEDICAL), Program Name (B.Sc. Nursing), Term (B.Sc. Nursing Semester - 1), Exam (B.S.C. NURSING SEMESTER - 1 SEPTEMBER-2023), Exam Type (Regular), and Payment Status (Pending). Below the form are four buttons: Search, Recon, Export All, and Duplicate Payment Data. The footer of the page includes the text 'Design By Guj Info Petro Limited'.